

સિટી ઓફ બ્રેમ્પટન યોજાશે નગરપાલિકાની ચૂંટણીના દાવેદારો માટે માહિતી સત્ર

બ્રેમ્પટન, ઓન્ટારિયો (31 માર્ચ 2022) – સંભવિત 2022 મ્યુનિસિપલ અને સ્કૂલ બોર્ડની ચૂંટણીના ઉમેદવારો અને તૃતીય પક્ષ જાહેરાતકર્તાઓને મંગળવાર, 12 એપ્રિલ, 2022 ના રોજ સાંજે 7 થી 10 વાગ્યા દરમિયાન સિટી ઓફ બ્રેમ્પટન સહ એક માહિતી સત્રમાં જોડાવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

મ્યુનિસિપલ અફેર્સ અને આવાસ મંત્રાલય સાથે ભાગીદારીમાં આયોજિત માહિતી સત્ર, બ્રેમ્પટન સિટી હોલમાં સ્થિત કાઉન્સિલ ચેમ્બર્સમાં આયોજિત વ્યક્તિગત અને વર્ચ્યુઅલ મિશ્ર સભા હશે.

સત્ર મુખ્ય આવશ્યકતાઓની ઝાંખી કરાવશે, જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:

- ઉમેદવાર અને તૃતીય પક્ષ જાહેરાતકર્તાની પાત્રતા અને જવાબદારીઓ
- નોમિનેશન અને પંચકરણ પ્રક્રિયા
- ઝુંબેશ અંગેના નાણાને લગતી બાબતો
- મુખ્ય તારીખો અને સંસાધનો

આ સત્ર એવા કોઈપણ વ્યક્તિ માટે ખુલ્લી છે જેઓ ઉમેદવાર તરીકે ઝંપલાવવાનો વિચાર કરતા હોય અથવા બ્રેમ્પટન નગરપાલિકા અને સ્કૂલ બોર્ડની ચૂંટણીમાં તૃતીય પક્ષ જાહેરાતકર્તા તરીકે નોંધણી કરાવવાના હોય. માહિતી સત્ર માટે રજિસ્ટર કરાવવું ફરજિયાત છે. વ્યક્તિગત રીતે અથવા વર્ચ્યુઅલ રીતે વેબેક્સ મારફતે હાજરીની નોંધણી માટે અહીં મુલાકાત લો brampton.ca/bramptonvotes.

હકિકતોનો ટૂંકસાર

- ઉમેદવાર અથવા તૃતીય પક્ષ જાહેરાતકર્તા બનવા માટેની માહિતી [અહીં મળશે](#).
- ઉમેદવાર નામાંકન સમયગાળો મે 2ના રોજ ખુલશે અને ઓગસ્ટ 19ના રોજ બપોરે 2 વાગ્યે સમાપ્ત થશે
- તૃતીય પક્ષ જાહેરાતકર્તા નોંધણી મે 2ના રોજ શરૂ થઈને ઓક્ટોબર 21ના રોજ અંત થશે
- ઓક્ટોબર 24 મતદાનનો દિવસ છે
- નામાંકિત ઉમેદવારો અને નોંધાયેલા તૃતીય પક્ષો માટે આગામી માહિતી સત્ર સપ્ટેમ્બર 2022 માં હાથ ધરાશે

સુવાક્યો

મ્યુનિસિપલ અફેર્સ અને આવાસ મંત્રાલય દ્વારા આયોજિત શહેરનું માહિતી સત્ર, સંભવિત ઉમેદવારોને 2022ની મ્યુનિસિપલ અને સ્કૂલ બોર્ડની ચૂંટણીમાં તેમનું નોમિનેશન ફાઇલ કરવાનું પસંદ કરે તો તેમના માટે શું જરૂરી છે તેની વધુ સારી સમજ મેળવવામાં મદદ કરશે અને સંભવિત તૃતીય પક્ષ જાહેરાતકર્તાઓને નોંધણીની જરૂરિયાતો વિશે જાણકારી મેળવવામાં મદદ કરશે. અમે વધુ શીખવામાં રસ ધરાવતા કોઈપણ વ્યક્તિને નોંધણી કરાવવા અને અમારી સાથે જોડાવા માટે આમંત્રિત કરીએ છીએ.

- પીટર ફે, 2022 બ્રેમ્પટન નગરપાલિકા ચૂંટણી માટેના સીટી ક્લર્ક એન્ડ રિટર્નિંગ ઓફિસર

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca